

ત્વરિત જાહેરાત માટે

રહેવાસીઓને બ્રેમ્પટનના હ્યુરોન્ટેરિયો-સ્ટીલ્સ વિસ્તારને પરિવર્તન કરતા વર્ચ્યુઅલ ટાઉન હોલમાં આમંત્રિત કરવામાં આવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 28, 2020) – રહેવાસીઓને ગુરુવાર, ઓક્ટોબર 8 નાં રોજ સાંજે 6 થી રાત્રે 8:30 કલાક સુધી ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટીસ (ટ્રાન્ઝિટલક્ષી સમુદાયો) અને અપટાઉન બ્રેમ્પટન હ્યુરોન્ટેરિયો-સ્ટીલ્સ એરિયા (સ્થાનિક સ્તરે શોપર્સ વર્લ્ડ તરીકે જાણીતા વિસ્તાર) વિશે વધુ માહિતી મેળવવા આમંત્રિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન, સીટી ઓફ હેલ્થિસિટી, ગ્રીનબર્ગ કન્સલ્ટન્ટ્સ અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કૂલ ઓફ સીટીસ સાથેના સહયોગમાં અર્બન લેન્ડ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આ આયોજનમાં, રહેવાસીઓ પાસે અપટાઉન શોપર્સ વર્લ્ડ સાઈટને બહુ ગીચ વસ્તીવાળા, મિશ્રિત-ઉપયોગી, કૌટુંબિક અનુકૂળ, આરોગ્યપ્રદ અને ચાલીને પહોંચી શકાતા ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટી ધરાવતા અર્બન કમ્યુનિટી હબ સાથે “20-મિનિટ વૉકેબલ નેબરહૂડ (ચાલીને પહોંચી શકાતા પાડોશ)”માં પરિવર્તન કરવાની આ રોમાંચક તક વિશે ઉદ્યોગ નિષ્ણાતો પાસેથી સાંભળવાની અને પ્રશ્નો પૂછવાની તક રહેશે.

નોટેબલ સ્પિકર્સ ઇન્ક્લૂડ (ઉલ્લેખનીય વક્તાઓમાં આમનો સમાવેશ થાય છે):

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન
- માર્ટિન મેડેયોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન
- એડુરાડો મોરેનો (Eduardo Moreno), ડાયરેક્ટર ઓફ સીટી પ્રોસ્પેરિટી ઇન્ડેક્સ (શહેર સમૃદ્ધિ સૂચકાંક), UN-હેબિટેટ
- ઓનરેબલ કિંગા સુરમા (Kinga Surma), એસોસિએટ ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર, ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટેશન
- જોનાથન ગિટ્લિન (Jonathan Gitlin), ચીફ ઓપરેટિંગ ઓફિસર, RioCan REIT
- એન્ની સિનેમાકિ (Anni Sinnemäki), ડેપ્યુટી મેયર ઓફ અર્બન એન્વાયરોન્મેન્ટ, સીટી ઓફ હેલ્થિસિટી
- જાની મોલિસ (Jani Moliis), હેડ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ, સીટી ઓફ હેલ્થિસિટી
- વોને યંગ (Yvonne Yeung), મેનેજર ઓફ અર્બન ડિઝાઇન, સીટી ઓફ બ્રેમ્પટન
- કેન ગ્રીનબર્ગ (Ken Greenberg), પ્રિન્સિપાલ, ગ્રીનબર્ગ કન્સલ્ટન્ટ્સ
- મેટ્ટી સીમિઆટીચી, ઇન્ટરિમ ડાયરેક્ટર, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કૂલ ઓફ સીટીસ
- બોબ બીયર્ક (Bob Bjerke), ડાયરેક્ટર ઓફ પોલિસી પ્લાનિંગ, સીટી ઓફ બ્રેમ્પટન
- રિચાર્ડ ફોર્વર્ડ (Richard Forward), કમિશ્નર, સીટી ઓફ બ્રેમ્પટન
- એન્ડ્ર્યુ ડંકન (Andrew Duncan), સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ઓફ ડેવલપમેન્ટ, RioCAN REIT
- ડૉ. લૉરેન્સ લૉહ (Dr. Lawrence Loh), મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, પીલ પબ્લિક હેલ્થ
- ડેવ કેપિલ (Dave Kapil), ચેર, ન્યૂ બ્રેમ્પટન

- રિચાર્ડ જોય (Richard Joy), એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર, ULI ટોરોન્ટો
- એમા વેસ્ટ (Emma West), ચેર, ULI ટોરોન્ટો

રહેવાસીઓ ટાઉન હાઉસ માટે [અહીં નોંધણી કરાવી શકે છે](#).

અપટાઉન બ્રેમ્પટન વિશે

અપટાઉન ફેમવર્ક પ્લાનથી બ્રેમ્પટન 2040 વિઝનનું અને 2018 થી 2022 નાં સમયગાળામાં કાઉન્સિલની અગ્રતાઓનું આગળ અમલીકરણ થશે જેમાં અપટાઉન વિસ્તારને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટીમાં પરિવર્તિત કરવા ખાનગી રોકાણને આકર્ષવામાં આવશે. ઘણાં મોટા ડેવલપર્સે બહુ રસ દેખાડ્યો છે અને આ પરિવર્તનથી સક્રિય પરિવહન માળખાગત સગવડોનું એકીકરણ કરીને, પબ્લિક ટ્રાન્ઝિટ અને સમગ્ર વહીવટી હેતુસર ચિલ્ડ્રન વિસ્તારમાં જોરદાર જાહેર જગ્યાઓની પહોંચ પૂરી પાડીને હાલમાં કાર ઓરિએન્ટેડ એરિયામાં પરિવર્તન લાવી શકાશે.

હ્યુરોન્ટેરિયો અને સ્ટીલ્સના ઈન્ટરસેક્શન સ્થિત – વર્ષ 2024 માં કાર્યરત થનારા લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ સ્ટેશનથી 5-મિનિટમાં ચાલીને પહોંચી શકાતા અંતરમાં સ્થિત - આ અર્બન નેબરહૂડ પોતાના હાર્દસમા શોપર્સ વર્લ્ડ અર્બન કમ્યુનિટી હબથી સ્થિર થશે. અપટાઉન હાર્દસમા વિસ્તારની ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટી તરીકે પુનઃકલ્પના કરતા, બ્રેમ્પટન રહેવાસીઓ વધેલું સામાજિક અને ભૌતિક જોડાણ, શહેરી ડિઝાઈન સહાયક સક્રિય જીવનશૈલીઓ, ઘટેલું પ્રદૂષણ, આર્થિક વિકાસ અને નોકરીઓ ઊભી થવાનો અનુભવ કરશે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન તકોને આગળ વધારતું એક વિચારશીલ શહેર છે, અને અમે ગતિશીલ, આરોગ્યપ્રદ અને સંપૂર્ણ સમુદાય માટે સ્માર્ટ આયોજનના માર્ગ તરફ આગળ વધવા કટિબદ્ધ છીએ. હું બધાં રહેવાસીઓને 20-મિનિટ વોકેબલ કમ્યુનિટીસ વિશે જાણવા અને તમે આ વિસ્તાર શું બનતો જોવા ઇચ્છો છો તે માટે તમારો અવાજ સંભળાવવા આ અપટાઉન બ્રેમ્પટન વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું. સાથે મળીને, આપણે અપટાઉન બ્રેમ્પટનની સંભાવનાઓ ઉઘાડી શકીએ છીએ.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“હ્યુરોન્ટેરિયો LRT નાં સ્ટીલ્સ સ્ટોપને મેટ્રોલિક્સ 2041 પ્રાદેશિક પરિવહન યોજના અને બ્રેમ્પટનની ઔપચારિક યોજનામાં ગેટવે મોબિલિટી હબ તરીકે નોંધવામાં આવ્યું છે. આ નિમાણકથી ઉચ્ચ ગુણવત્તાવાળી ચાલવાની અને સાઈકલિંગ કરવાની માળખાગત સગવડો સહિત, બહુ ગીચ વસ્તીમાં વિકાસ અને પ્રવાસના બહુવિધ માધ્યમો માટે ડિઝાઈન વિચારણાઓને સહાયતા મળે છે. જો વૈશ્વિક મહામારીએ આપણને કંઈક શીખવ્યું હોય તો, તેનાથી એ જોવા મળ્યું છે કે આપણે નવા પડકારો અને બદલાતી વર્તાણકોને અનુકૂળ થવા તૈયાર રહેવું પડશે. અપટાઉનને ટ્રાન્ઝિટલક્ષી સમુદાયમાં પરિવર્તન કરવું એક પરિપૂર્ણ સમજ દર્શાવે છે.”

- *માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“અર્બન કમ્યુનિટી હબની અમલીકરણ યોજનાથી અપટાઉનના હાર્દમાં ઉભરી રહેલાં અર્બન હબની ડિઝાઈનને માર્ગદર્શન મળે છે. આ સફળ સ્થળ-બનાવતી વ્યૂહરચનાઓમાંથી મેળવાતા લાભો આર્થિક અને માનવીય બંને સંદર્ભોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આમાં નોકરીઓ ઊભી કરવી, સુધારેલું જાહેર આરોગ્ય, સામાજિક સ્નેહાકર્ષણ, અને પર્યાવરણલક્ષી અનુકૂળ ફૂટપ્રિન્ટ પર વિચારપૂર્વકના વિકાસનો સમાવેશ થાય છે.

આ વર્યુઅલ ઈવેન્ટ બ્રેમ્પટનવાસીઓને પ્રવૃત્તમય થવા અને આ રોમાંચક પ્રોજેક્ટ પર આગળ સહયોગ પ્રેરિત કરવા એક આશ્ચર્યજનક તક પૂરી પાડે છે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, આયોજન અને વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરમાં, અમે આપણાં રહેવાસીઓના મૌલિક વિચારો અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરતા રહેવા યોગ્ય, આરોગ્યપ્રદ અને સંપૂર્ણ સમુદાયોના એવા આયોજનમાં સમર્પિત છીએ. અપટાઉન બ્રેમ્પટન વર્યુઅલ ટાઉન હાઉસ બ્રેમ્પટનવાસીઓને અપટાઉન બ્રેમ્પટન માટે સીટીની યોજનાઓ વિશે વધુ જાણવા, કર્મચારીઓને પ્રશ્નો પૂછવા અને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટી તરીકે આ વિસ્તારને કેવી રીતે વિકસાવવો જોઈએ તે અંગે પોતાના મૌલિક વિચારોનો ફાળો આપવાની તક પૂરી પાડશે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“આગામી ઘણાં વર્ષો આપણાં પ્રદેશના વિકાસમાં નિર્ણાયક વળાંક આપતી ક્ષણ ઊભી કરે છે. આપણે જાહેર નીતિ બનાવનારાઓ, ઉદ્યોગ, અને સ્થાનિક સમુદાયો વચ્ચે હકારાત્મક આગેવાની મારફતે નવીન અને જવાબદાર વિકાસના અમલીકરણને આગળ વધારવા રહેવા યોગ્ય, વ્યાજબી, વૈવિધ્યસભર, અને સર્વગ્રાહી પાડોશના દૂરદેશીપણાંને આગળ વધારવું રહ્યું. બ્રેમ્પટનનો પ્રોએક્ટિવ (પહેલેથી સક્રિય રહેવાનો) અભિગમ આ માર્ગમાં અગ્રગામી છે અને આના જેવા ઈવેન્ટ્સનું આયોજન આપણાં કુટુંબો માટે કયા પ્રકારના શહેરો આપણને જોઈએ છે તે અંગે વધારે મોટા પ્રમાણમાં વાતચીત કરવા પર વધારે સારા સહયોગને પોષે છે અને વિસ્તારે છે.”

- રિચાર્ડ જોય (Richard Joy), એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર, અર્બન લેન્ડ ઈન્સ્ટિટ્યુટ, ટોરોન્ટો

“અમે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વિકાસની ચર્ચામાં સહભાગી થવા રાજી અને રોમાંચિત છીએ. હેલ્સિંકી પણ ઝડપી વિકાસથી ઘણાં પડકારોનો સામનો કરી રહ્યું છે પરંતુ આપણાં ભાવિનું આયોજન કરવામાં રોમાંચ પણ છે. હું ઈચ્છું છું કે તમારી ચર્ચાઓ ફળદાયી રહે અને હું સાથે જ આશાવાદી છું કે હેલ્સિંકીનો અનુભવ નવા અપટાઉન અર્બન હબ માટે બ્રેમ્પટનની યોજનાઓને પ્રેરણા મેળવવામાં મદદરૂપ થશે.”

- એની સિનેમાકિ (Anni Sinnemäki), ડેપ્યુટી મેયર, સીટી ઓફ હેલ્સિંકી અને પ્રમુખ - શહેરી પર્યાવરણ

“બ્રેમ્પટન શોપર્સ વર્લ્ડની આસપાસના અપટાઉનમાં સ્વીકારેલું 2040 વિઝન પરિપૂર્ણ કરવા રોમાંચક પગલું આગળ વધારવા સંતુલિત છે. સીટી, આ પ્રદેશ અને પ્રોવિન્સ સાથેના સહયોગમાં, છ મોટા ડેવલપર્સ સ્ટીલ્સ અને હ્યુરોન્ટેરિયો/મેઈન સ્ટ્રીટમાં લાઈટ રેઈલના અપેક્ષિત આગમનની આસપાસ 20-મિનિટ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ, વૉકેબલ નેબરહૂડ માટે ડિઝાઈનની આગેવાનીમાં વિઝનનું અમલીકરણ કરવા સક્રિય થવાની રાહ જુએ છે. આ પહેલ આ જીવાન, ગતિશીલ, અને ઝડપથી વિકસી રહેલી GTA મ્યુનિસિપાલિટી માટે વધારે ટકાઉ, સર્વગ્રાહી, અને સમૃદ્ધ ભવિષ્યના માર્ગ તરફ દિશાસૂચન કરે છે.”

- કેન ગ્રીનબર્ગ (Ken Greenberg), પ્રિન્સિપાલ, ગ્રીનબર્ગ કન્સલ્ટન્ટ્સ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca